



માર્ચ 2019

સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46ના પ્રિય માતાપિતા અને વાલીઓ,

દરેક વસંતઋતુના સમયમાં અમારા વિદ્યાર્થીઓનું સંઘીય-જરૂરિયાત અનુસાર રાજ્ય સ્તરે આકલન કરવું જરૂરી હોય છે. અમારા વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં તેમના અન્ય સમકક્ષોની તુલનાએ શૈક્ષણિક સ્તરે કેવો દેખાવ કરી રહ્યા છે અને કેવી પ્રગતિ કરી રહ્યા છે તે આઆકલનના આધારે સમજવામાં મદદ મળી શકે છે. રાજ્ય દ્વારા આમાહિતીનો ઉપયોગ શાળાઓને શ્રેષ્ઠત્તમ જરૂરિયાતો અનુસાર વધુ સહકાર આપવા માટે અને વધુ સ્ત્રોતો પૂરા પાડવા માટે કરવામાં આવે છે. આવર્ષે, ગ્રેડ 3-8 માટે અંગ્રેજી ભાષા, આર્ટ્સ અને ગણિત માટેના આકલનને ઈલિનોઈસ એસેસમેન્ટ ઓફ રેડિનેસ કહેવામાં આવ્યું છે.

ઈલિનોઈસ એસેસમેન્ટ ઓફ રેડિનેસ મોટાભાગે તદ્દન આવર્ષે રાજ્ય સરકારના આકલનજેવું જ છે જે ગત વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર તેનાથી સહેજ ટૂંકું છે. ઈલિનોઈસ એસેસમેન્ટ ઓફ રેડિનેસમાં એ માપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં [ઈલિનોઈસ શિક્ષણ માપદંડો](#)માં પરિપૂર્ણ છે અને તેમાં એજ ઉચ્ચ-ગુણવત્તાના પરીક્ષા પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે જે છેલ્લા ચાર વર્ષમાં ઉપયોગમાં લેવાયા છે.

અમારા વિદ્યાર્થીઓ ઈલિનોઈસ એસેસમેન્ટ ઓફ રેડિનેસ માટે તેઓ શું જાણે છે અને તેઓ શું કરી શકે છે તે બતાવવા માટે તૈયાર હોવાનું અનુભવે છે, ભલે તેમાં પરીક્ષાનું નવું નામ હોય અને નવો દેખાવ હોય.

આવર્ષે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46માં પરીક્ષણની વિન્ડો એપ્રિલ 1ના રોજ ખુલશે અને એપ્રિલ 26 સુધી સતત ખુલ્લી રહેશે. આચાર્યો તેમની શાળાઓ દ્વારા ચોક્કસ પરીક્ષા એડમિનિસ્ટ્રેશન પહેલા જ પરિવારોને જાણ કરશે.

જો ઈલિનોઈસ એસેસમેન્ટ ઓફ રેડિનેસ અંગે તમને કોઈ પ્રશ્નો હોય તો, કૃપા કરીને અમારા આચાર્યનો સંપર્ક કરો અથવા આકલન અને જવાબદારી વિભાગ સાથે [ચાલો વાત કરીએ](#) દ્વારા અથવા નીચે આપેલા



ફોન નંબર દ્વારા સંપર્ક કરો. હંમેશાની જેમ, અમારા વિદ્યાર્થીઓ દરરોજ પોતાની રીતે શ્રેષ્ઠ પરિણામ આપે તે માટે અમે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ. તમારા સંતાનની શૈક્ષણિક સફળતામાં સહભાગી થવા બદલ આપનો આભાર.

આપની નિષ્ઠામાં,

*Laura Hill*

લૌરા હિલ

આકલન અને જવાબદારી વિભાગના ડાયરેક્ટર

સ્કૂલ ડિસ્ટ્રિક્ટ U-46

847-888-5000, એક્સટેન્શન 5677